

B.Ed. Semester - 2 (CBCS) Examination
March/April- 2019 (New Course)
Accountancy Content (GROUPACONTENT-1)

Time: 1:15 Hours

Marks: 35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧** નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો. (૦૫)
- ૧.૧ સિધ્ધાંતની ભૂલ એટલે શું?
 - ૧.૨ ઘસારાનો અર્થ આપો?
 - ૧.૩ જોગવાઈ એટલે શું?
 - ૧.૪ કાચો નફો કે કાચી ખોટ એટલે શું?
 - ૧.૫ આવરો એટલે શું?
- પ્રશ્ન-૨** નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપો. (૬ માંથી ૫) (૧૦)
- ૨.૧ ઉપલક ખાતુ એટલે શું?
 - ૨.૨ ઘસારાના લક્ષણો સ્પષ્ટ કરો.
 - ૨.૩ જોગવાઈના લક્ષણો સ્પષ્ટ કરો.
 - ૨.૪ કામગીરી નફો એટલે શું?
 - ૨.૫ દેશી નામા પદ્ધતિ ના કોઈપણ ચાર લક્ષણો સ્પષ્ટ કરો.
 - ૨.૬ કમ્પ્યુટર આધારિત હિસાબી પદ્ધતિના કોઈ પણ ચાર લક્ષણો સ્પષ્ટ કરો.
- પ્રશ્ન-૩** નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. (૬ માંથી ૫) (૨૦)
- ૩.૧ હિસાબી ભૂલોના પ્રકારની માત્ર ચાલી જણાવો.
 - ૩.૨ એક મશીન ની કિંમત ૩૭૦૦૦ રૂપિયા છે તે મશીન ગોઠવવાનો ખર્ચ ૩૦૦૦ થયો આ મશીનનું અંદાજિત આયુષ્ય ૧૦ વર્ષ છે તથા આ મશીનની ભંગાર કિંમત ૬૦૦૦ અંદાજવામાં આવેલ છે સરખા હપ્તાની પદ્ધતિ મુજબ ઘસારો ગણી પ્રથમ ત્રણ વર્ષની આમનોંધ તૈયાર કરો.
 - ૩.૩ સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચે તફાવતના ચાર મુદ્દા જણાવો.
 - ૩.૪ કાચું સરવૈયું અને પાકું સરવૈયું વચ્ચે તફાવતના ચાર મુદ્દા જણાવો.
 - ૩.૫ ફાકું મારવું એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો.
 - ૩.૬ કમ્પ્યુટર આધારિત હિસાબી પદ્ધતિના ફાયદાઓ સ્પષ્ટ કરો.

ENGLISH VERSION

Que.1 Answer each of the following in brief.

(05)

- (1.1) What is error of principle?
- (1.2) What is depreciation?
- (1.3) What is provision?
- (1.4) What is Gross profit or gross loss?
- (1.5) What is aavaru?

Que.2 Answer any five from the following. (5 out of 6)

(10)

- (2.1) What is suspense account?
- (2.2) Explain the characteristics of depreciation ?
- (2.3) Explain the characteristics of provision?
- (2.4) What is Operating profit?
- (2.5) Mention any four characteristics of deshi nama system?
- (2.6) Mention any four characteristics of computer based accounting.

Que.3 Answer any 5 from the following in detail. (5 out of 6)

(20)

- (3.1) List out types of accounting errors.
- (3.2) Price of a machine is rs.37000. Installation cost is rs.3000. expected life of the machine is 10 years. Scrap value of the machine is expected to be rs. 6000. Calculate depreciation under straight line method of depreciation. And prepare journal entry for first three year.
- (3.3) Explain the four difference between general reserve and capital reserve.
- (3.4) Explain the four difference between trail balance and balance sheet .
- (3.5) What is 'Fanku Maravu'? explain with example.
- (3.6) Explain advantages of computer accounting.
